પાલનપુર નગરપાલિકા માટે સંભવિતોની ચાદી તૈચાર

Gujarat State Petronet imited

Regd Office: GSPC Bhavan, Sector - 11, Gandhinagar - 382 010. Tel.: +91-79-66701001 Fax: +91-79-23236477

T OF UNALIDITED FINANCIAL RESULTS FOR THE OUARTER AND HALF YEAR ENDED

Part I	TATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30 [™] SEPTEMBER 2015 Standalone Results				(₹ in Lakhs)		
Sr. No.	Particulars	30.09.2015	3 months ended 30.06.2015			ar ended 30.09.2014	Year ended 31.03.2015
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Income from Operations a) Net Sales/Income from Operations	25,257.80	25,567.99	35,103.22	50,825.79	58,147.05	1,06,056.01
	b) Other Operating Income c) Total Income from Operations	20.25 25,278.05	346.32 25,914.31	84.40 35,187.62	366.57 51,192.36	131.15 58,278.20	403.64 1,06,459.65
2	Expenses a) Employee benefit expenses	1,130.27	738.60	704.21	1,868.87	1,465.19	3,556.37
	 b) Depreciation & amortisation expense c) Operation & Maintenance expense c) Operation & Maintenance expense 	4,641.27	4,343.36 1,931.34	4,656.56	8,984.63 3,138.21	9,350.32 3,211.02	20,133.33 7,217.41
_	d) Other expenses e) Total expenses	523.15 7,501.56	532.45 7,545.75	675.84 7,449.66	1,055.60 15,047.31	1,167.66 15,194.19	2,938.35 33,845.46
3	Profit/(Loss) from operations before other income, finance cost and exceptional items (1-2)	17,776.49	18,368.56	27,737.96	36,145.05	43,084.01	72,614.19
4 5	Other Income Profit/(Loss) from ordinary activities before	1,202.58 18,979.07	1,079.53 19,448.09	1,433.37 29,171.33	2,282.11 38,427.16	2,735.49 45,819.50	5,200.52 77,814.71
6 7	finance cost & exceptional items (3+4) Finance costs Profill() and finance costs	2,129.95	2,072.90	3,072.37	4,202.85	6,278.09	11,782.52
8	Profit/(Loss) from ordinary activities after finance cost but before exceptional items (5-6) Exceptional Items	16,849.12	17,375.19	26,098.96	34,224.31	39,541.41	66,032.19
9 10	Profit/(Loss) from ordinary activities before tax (7+8) Tax Expense	16,849.12 5,996.66	17,375.19 6,099.09	26,098.96 9,151.82	34,224.31 12,095.75	39,541.41 14,094.50	66,032.19 24,996.02
10	- Income Tax - Deferred Tax	5,990.00 5,133.47 863.19	5,664.00 435.09	8,567.49 584.33	12,095.75	13,025.97	21,981.19 3,014.83
11 12	Net Profit /(Loss) from ordinary activities after tax (9-10) Extraordinary Items (net of tax expenses)	10,852.46	11,276.10	16,947.14	22,128.56	25,446.91	41,036.17
13 14	Net Profit/(Loss) for the period (11-12) Paid-up Equity Share Capital (face value of Rs. 10/- each)	10,852.46 56,310.07	11,276.10 56,305.02	16,947.14 56,276.57	22,128.56 56,310.07	25,446.91 56,276.57	41,036.17 56,298.00
15	Reserves excluding revaluation reserves as per balance sheet of previous accounting year						3,06,007.16
16 i.	and a second	1.93	2.00	3.01	3.93	4.52	7.29
	b) Diluted EPS (Rs.) (face value of Rs. 10/- each)	1.93 (not annualised)	2.00 (not annualised)	3.01	3.93 (not annualised)	4.52 (not annualised)	7.29
16 ii.	Earnings per share(EPS) after Extraordinary items a) Basic EPS(Rs.)	1.93	2.00	(not annualised) 3.01	3.93	4.52	7.29
	b) Diluted EPS(Rs.) (face value of Rs. 10/- each)	1.93 (not annualised)	2.00	3.01 (not annualised)	3.93	4.52 (not annualised)	7.29
Part II	la se conservation de la cons	LF YEAR END	ED 30 [™] SEPT	EMBER 2015			
Sr. No.	Particulars	30.09.2015	3 months ended 30.06.2015	30.09.2014	Half yea 30.09.2015	ar ended 30.09.2014	Year ended 31.03.2015
A 1	Particulars of Shareholding Public Shareholding					1.000	
	Number of Shares Percentage of Shareholding	35,07,95,411 62.30%	35,07,44,949 62.29%	35,04,60,443 62.27%	35,07,95,411 62.30%	35,04,60,443 62.27%	35,06,74,710 62.29%
2	Promoters and Promoter Group Shareholding a) Pledged / Encumbered	17					A.U.
	 Number of shares Percentage of shares (as a % of the total shareholding of Promoter and Promoter group) 	Nil	Nil	Nil Nil	Nil	Nil	Nil
	 Percentage of shares (as a % of the total share capital of the Company) 	Nil	Nil	Nil	Nil	Nil	Nil
	 b) Non - encumbered Number of shares 	21,23,05,270	21,23,05,270	21,23,05,270	21,23,05,270	21,23,05,270	21,23,05,270
	 Percentage of shares (as a % of the total shareholding of the Promoter and Promoter group) 	100.00%	100.00%	100.00%	100.00%	100.00%	100.00%
	 Percentage of shares (as a % of the total share capital of the Company) 	37.70%	37.71%	37.73%	37.70%	37.73%	37.71%
Sr. No.	Particulars	3 months ender 30.09.2015	ł				
В	Investor Complaints Pending at the beginning of the quarter	0					
	Received during the quarter Disposed of during the quarter	23	E .				
_	Remaining unresolved at the end of the quarter SEGMENT-WISE REVENUE, RESULTS AND CAPITAL EMPLOYI	0 ED FOR THE QU		LF YEAR ENDE	D 30 [™] SEPTEME	BER 2015	(₹ in Lakhs)
Sr.			3 months ended	Standalor		ar ended	Year ended
No.	Particulars	30.09.2015 (Unaudited)	30.06.2015 (Unaudited)	30.09.2014 (Unaudited)	30.09.2015 (Unaudited)	30.09.2014 (Unaudited)	31.03.2015 (Audited)
1	Segment Revenue (Net Sales / Income)	23,898.09	24,779.40	33,965.78	48,677.49	55,758.67	1,02,983.79
	A. Gas Transportation		1,185.59	1,247.18	2,572.96		
	A. Gas Transportation B. Sale of Electricity Total	1,387.37	25,964.99	35,212.96		2,637.02 58,395.69	3,750.80 1,06,734.59
	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue	1,387.37		the second s	51,250.45 - 51,250.45	the second se	1,06,734.59
2	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results:	1,387.37 25,285.46	25,964.99	35,212.96	51,250.45	58,395.69	
2	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation	1,387.37 25,285.46	25,964.99	35,212.96	51,250.45 51,250.45 36,134.99	58,395.69	1,06,734.59
2	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax	1,387.37 25,285.46 25,285.46 17,692.53	25,964.99 25,964.99 18,442.47	35,212.96 35,212.96 28,220.71	51,250.45 - 51,250.45	58,395.69 58,395.69 43,824.65	1,06,734.59 1,06,734.59 76,043.75
2	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total	1,387.37 25,285.46 25,285.46 17,692.53 738.70 18,431.23	25,964.99 	35,212.96 	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90	58,395.69 	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23
2	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax	1,387.37 25,285.46 25,285.46 17,692.53 738.70 18,431.23 2,129.95 647.30	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44	35,212.96 	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10
	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities)	1,387.37 25,285.46 25,285.46 17,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19	35,212.96 	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19
	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed:	1,387.37 25,285.46 25,285.46 17,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62	35,212.96 	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84	58,395.69 	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94
	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98	35,212.96 	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38	58,395.69 	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87
3	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	58,395.69 	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36
	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87
3 Sr.	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09.2015	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015
3 Sr. No.	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited)
3 Sr. No. A 1	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less: (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09,2015 sudited)	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited)
3 Sr. No.	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09,2015 mudited) 56,310.07 3,28,273.82 3,84,583.89	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14
3 Sr. No. A 1	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings b) Deferred tax liabilities(net)	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14
3 Sr. No. A 1	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09.2015 nudited) 56,310.07 3,28,273.82 3,84,583.89 86,455.22 46,337.76 2,725.74 817.37	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 56,298.00 3,06,007.14 3,62,305.14 - 88,788.07 45,039.48 2,505.78 801.40
3 Sr. No. A 1	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities (a) Long-term borrowings b) Deferred tax liabilities(net) c) Other long-term liabilities Current liabilities	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09,2015 sudited) 56,310.07 3,28,273.82 3,84,583.89 86,455.22 46,337.76 2,725.74	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14 - 88,788.07 45,039.48 2,505.78 801.40 1,37,134.73
3 Sr. No. 1 2 3	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings b) Deferred tax liabilities(net) c) Other long-term liabilities a) Trade payables b) Other current liabilities a) Trade payables b) Other current liabilities	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03,2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14 3,62,305.14 3,62,305.78 801.40 1,37,134.73 4,045.50 42,215.00
3 Sr. No. 1 2 3	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings b) Deferred tax liabilities(net) c) Other long-term liabilities a) Trade payables b) Other current liabilities c) Short-term provisions	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1.277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09,2015 sudited) 56,310.07 3,28,273.82 3,84,583.89 86,455.22 46,337.76 2,725.74 817.37 1,36,336.09 1,808.99 50,377.24 1,252.71 53,438.94	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14 - 88,788.07 45,039.48 2,505.78 801.40 1,37,134.73 4,045.50 4,2,215.00 8,330.07 54,590.57
3 Sr. No. 1 2 3	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Share holders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings b) Deferred tax liabilities (c) Other long-term liabilities a) Trade payables b) Other current liabilities c) Short-term provisions Total Equity and Liabilities ASSETS	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09,2015 mulited) 56,310.07 3,28,273.82 3,84,583.89 	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14
3 Sr. No. A 1 2 3 4	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings b) Deferred tax liabilities(net) c) Other long-term liabilities a) Trade payables b) Other current liabilities c) Short-term provisions Total Equity and Liabilities ASSETS Non-current assets a) Fixed Assets	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09.2015 mudited) 56,310.07 3,28,273.82 3,84,583.89 86,455.22 46,337.76 2,725.74 817.37 1,36,336.09 1,808.99 50,377.24 1,252.71 53,438.94 5,74,358.92 3,89,984.72	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59
3 Sr. No. A 1 2 3	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings b) Deferred tax liabilities(net) c) Other long-term liabilities a) Trade payables b) Other current liabilities c) Short-term provisions Total Equity and Liabilities ASSETS Non-current assets a) Fixed Assets b) Non-current investments c) Long term loans and advances	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14 - 88,788.07 45,039.48 2,505.78 801.40 1,37,134.73 4,045.50 42,215.00 8,330.07 54,590.57 5,54,030.44 3,84,188.73 64,865.45 29,339.35
3 Sr. No. A 1 2 3	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less : (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities (a) Long-term provisions Current liabilities (b) Other ong-term provisions Current liabilities (c) Short-term provisions Total Equity and Liabilities (c) Short-term provisions Total Equity and Liabilities (c) Long term loans and advances (c) Other non-current assets (c) Oth	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03,2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14 3,62,305.14 - 88,788.07 45,039.48 2,505.78 801.40 1,37,134.73 4,045.50 42,215.00 8,330.07 54,590.57 5,54,030.44 3,84,188.73 64,865.45
3 Sr. No. A 1 2 3 4 8 1	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less: (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Income Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities (a) Long-term borrowings b) Deferred tax liabilities(net) (c) Other long-term provisions Current liabilities a) Trade payables b) Other current liabilities (c) Short-term provisions Total Equity and Liabilities (c) Short-term provisions Total Equity and Liabilities (c) Long term loans and advances (c) Other non-current assets a) Fixed Assets (c) Other non-current assets (c	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09.2015 nudited) 56,310.07 3,28,273.82 3,84,583.89 86,455.22 46,337.76 2,725.74 817.37 1,36,336.09 1,808.99 50,377.24 1,252.71 53,438.94 5,74,358.92 3,89,984.72 66,165.45 3,922.46 3,99,984.72 66,165.45 3,922.46 3,1923.48 4,88,686.56 11,505.69	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 56,298.00 3,06,007.14 3,62,305.14 74,503.48 2,505.78 801.40 1,37,134.73 4,045.50 42,215.00 83,30.07 54,590.57 5,54,030.44 3,84,188.73 64,865.45 29,339.35 1,080.08 4,79,473.61 1,023.50
3 Sr. No. A 1 2 3 4 8 1	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profil/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less: (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Expenditure Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Share holders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings b) Deferred tax liabilities () Current liabilities a) Trade payables b) Other current liabilities c) Short-term provisions Total Equity and Liabilities ASSETS Non-current investments c) Long term loans and advances d) Other non-current assets a) Fixed Assets b) Non-current assets current assets Current assets	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 36,134.99 1,277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09,2015 nudited) 56,310.07 3,28,273.82 3,84,583.89 86,455.22 46,337.76 2,725.74 817.37 1,36,336.09 1,808.99 50,377.24 1,252.71 53,438.94 5,74,358.92 3,89,984.72 66,165.55 31,922.46 6,13.93 4,88,686.56	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 56,298.00 3,06,007.14 3,62,305.14 745,039.48 2,505.78 801.40 1,37,134.73 4,045.50 42,215.00 8,330.07 54,590.57 5,54,030.44 3,84,188.73 64,865.45 29,339.35 1,080.08 4,79,473.61
3 Sr. No. A 1 2 3 4 8 1	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less: (i) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term provisions Current liabilities a) Trade payables b) Other current liabilities a) Trade payables b) Other current liabilities c) Short-term provisions Total Equity and Liabilities b) Non-current investments c) Long term bornowings b) Defered tax sets a) Fixed Assets b) Non-current investments c) Long term lones and advances d) Other non-current assets a) Fixed Assets b) Non-current assets current assets a) Inventories b) Trade receivables c) Cash and cash equivalents	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03,2015 dited) 56,298.00 3,06,007.14 3,62,305.14 3,62,305.14 3,62,305.14 3,62,305.78 801.40 1,37,134.73 4,045.50 42,215.00 8,330.07 54,590.57 5,54,030.44 3,84,188.73 64,865.45 29,339.35 1,080.08 4,79,473.61 11,023.50 15,039.25 43,515.25
3 Sr. No. A 1 2 3 4 4	B. Sale of Electricity Total Less: Inter-Segment Revenue Sales / Income from Operations Segment Results: Profit/(Loss) before Interest & Tax A. Gas Transportation B. Sale of Electricity Total Less: (i) Interest & Financial Charges (ii) Other Un-allocable Expenditure Add : (iii) Other Un-allocable Income Total Profit before Tax Capital Employed: (Segment Assets Less Segment Liabilities) A. Gas Transportation B. Sale of Electricity C. Un-allocable Total STANDALONE STATEMENT OF ASSETS AND LIABILITIE Particulars EQUITY AND LIABILITIES Shareholders' Funds: a) Share Capital b) Reserves & Surplus Share application money pending allotment Non-current liabilities a) Long-term borrowings b) Deferred tax liabilities(net) c) Other long-term liabilities a) Trade payables b) Other current liabilities a) Trade payables b) Other current liabilities ASSETS Non-current assets a) Fixed Assets b) Non-current assets current assets b) Non-current assets c) Long term lones and advances c) Current current assets c) Long term loans and advances c) Other rurent assets c) Current current assets c) C	1,387.37 25,285.46 7,692.53 738.70 18,431.23 2,129.95 647.30 1,195.14 16,849.12 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72	25,964.99 25,964.99 18,442.47 539.21 18,981.68 2,072.90 562.44 1,028.85 17,375.19 3,90,009.98 15,961.62 1,33,112.84	35,212.96 35,212.96 28,220.71 497.37 28,718.08 3,072.37 954.76 1,408.01 26,098.96 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 As at 3	51,250.45 51,250.45 51,250.45 36,134.99 1.277.91 37,412.90 4,202.85 1,209.73 2,223.99 34,224.31 3,89,110.38 15,213.84 1,38,719.50 5,43,043.72 Standalo 0.09,2015 mudited) 56,310.07 3,28,273.82 3,84,583.89 56,310.07 3,28,273.82 3,84,583.89 56,310.07 3,28,273.82 3,84,583.89 1,306,336.09 1,808.99 50,377.24 1,252.71 53,438.94 5,74,358.92 3,89,984.72 66,165.45 31,922.46 613.93 4,88,686.56 11,505.69 16,042.58 54,375.39 2,955.38 793.32	58,395.69 58,395.69 43,824.65 1,188.76 45,013.41 6,278.09 1,811.89 2,617.98 39,541.41 3,87,383.36 17,210.12 1,31,921.13 5,36,514.61 ne Results As at 3	1,06,734.59 1,06,734.59 76,043.75 940.48 76,984.23 11,782.52 4,095.10 4,925.58 66,032.19 3,86,362.57 15,999.94 1,20,731.36 5,23,093.87 (₹ in Lakhs) 1.03.2015 dited) (₹ in Lakhs) 56,298.00 3,06,007.14 3,62,305.14 3,86,788.07 45,039.48 2,505.78 801.40 1,37,134.73 4,045.50 42,215.00 8,330.07 54,590.57 5,54,030.44 3,84,188.73 64,865.45 29,339.35 1,080.08 4,79,473.61 11,023.50 15,039.25 3,648.56 1,330.27

મેઘરજનો ઓડ સમાજનો યુવાન ગુજરાત રાજ્યમાં ઝળક્યો

ઈસરી, તા. ૬ ગુજરાત અને રાજસ્થાન ઓડ સમાજ દારા દિલ્હી ખાતે ગોવિંદપુરી અગ્રવાલ ધર્મશાળામાં ઓલ ઈન્ડિયા ઓડ સમાજના ઉ. પ્રદેશ, મ. પ્રદેશ, કર્ણાટક, કેરાલા, આંધ્રપ્રદેશ, હરિયાણા, પંજાબ, ગોવા, ઓરીસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઉત્તરાખંડ વગેરે દરેક રાજ્યના છ-છ સભ્યોની રાષ્ટ્ર કક્ષાની ટીમની નિમણૂંક ઓડ સમાજ દ્વારા કરવામાં આવી હતી. સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરલાલજી ઓડ-રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સરદારભાઈ પદમાજી ઓડ રાષ્ટ્રીય સચિવ નારણભાઈ ઓડ, લાલચંદજી ઓડ, રાષ્ટીય જનરલ સેક્રેટરી જનકસિંહ ઓડ, ઉપસચિવ કેશભાઈ ઓડ, જોઈન્ટ વાઈસ સેક્રેટરી સુનિલભાઈ ઓડ તેમજ સુરેશભાઈ ઓડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દિલ્હીમાં માઈન્સ વિસ્તારમાં ઓડ સમાજના બે હજાર જેટલા મકાનો-કોમ્યુનીટી હોલ-કોમ્પ્યુટર સેટ પાંચ સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ગુરુજી દ્વારા અર્પણાવિધિ કરવામાં આવી હતી.



મોકડ્રીલ : અમદાવાદમાં ભૂકંપ આવે તો વહેલી તકે કયા પગલા લઈ શકાય તે સંદર્ભમાં વિવિધ વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આલ્ફા વન મોલ અને જીએમડીસીમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું.

પાલનપુર નગરપાલિકા માટે સંભવિતોની યાદી તૈયાર

જિલ્લામથક પાલનપુરમાં દારાપણ ૪૪ વોર્ડમાટે સંભવિત ૨૦૦ સૂત્રો પાસેથી જાણવા મળ્યા છે જો કે કુલ ૧૧ વોર્ડ આવેલા છે જેમાં ૪૪ કેટલાકવિસ્તાર માટેનવા ચહેરાને સ્થાન ઉમેદવારો માટે ભાજપ અને આપવાની તજવીજ ચાલી રહી છે. જો કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવારોની યાદી કે છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં તૈયાર કરાઈ છે જે મુજબ ભાજપ માટે કેટલાક નગરસેવકોએ પાર્ટી તેમજ ૪૪ ઉમેદવારો માટે ૨૮૦ની યાદી સરકાર વિરોધી જૂથોને ખુલ્લેઆમ ટેકો બનાવી છે. જ્યારે સામા પક્ષે કોંગ્રેસ આપતા બાદબાકી થવાના સમાચાર પણ

છોટા રાજન

• અનુસંધાન પહેલાનું ચાલુ

રાજનને દિલ્હીમાં લવાય તે પહેલાથી મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ગુરૂવાર રાત્રેથી જ તમામ જગ્યાએ પોલીસ ટુકડી ગોઠવાઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયન પોલીસ તરફથી બાતમી મળ્યા બાદ ઈન્ડોનેશિયન સત્તાવાળાઓએ છોટા રાજન ઉર્ફે રાજન સદાશિવ નિખાલજેની ધરપકડ કરી હતી. અત્રે નોંધનીય છે કે રાજનની ૨૫મી ઓક્ટોબરના દિવસે ઓસ્ટ્રેલિયાથી બાલીમાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ, મુંબઈ, દિલ્હી પોલીસની ટુકડી રવિવારના દિવસે બાલી પહોંચી હતીભારતીય ટીમ દ્વારા પ્રથમ વખત રાજનની પુછપરછ કરાઈ હતી. ઈન્ડોનેશિયા સાથે પ્રત્યાર્પણ સમજૂતિ નહીં હોવાથી ભારતીય સત્તાવાળાઓને રાજનની ઓળખ આપવા સાથે સંબંધિત જરૂરી દસ્તાવેજ સોંપવાની ફરજ પડી હતી. તેની ધરપકડના અહેવાલ આવ્યા બાદ શરૂઆતમાં ગુંચવણભરી સ્થિતિ રહી હતી.

રેલવે ટિક્ટિ

• અનુસંધાન પહેલાનું ચાલુ

કેન્સલેશન નિયમોમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. રેલવે દ્વારા એસી ફર્સ્ટ ક્લાસ, એક્ઝીક્યુટીવ ક્લાસ માટે ૨૪૦ રૂપિયા કપાત રહેશે. જ્યારે એસી ટુ ટાયર, ફર્સ્ટ ક્લાસ માટે ૨૦૦ રૂપિયા કાપી લેવામાં આવશે. જ્યારે એસી થ્રી ટાયર માટે ૧૮૦ અને સ્લીપર ક્લાસ માટે ૧૨૦ રૂપિયા અને સેકન્ડ ક્લાસ માટે ૬૦ રૂપિયા કાપી લેવામાં આવશે. પરિપત્ર તૈયાર કરી લેવામાં આવ્યો છે. જેમાં સ્ટેશન માસ્તરને કેન્સલેશનની સત્તા આપવામાં આવશે. જો યાત્રી કાઉન્ટર ઉપર પોતાની ટિકિટ રદ કરાવવામાં નિષ્ફળ રહેશે તો સ્ટેશન માસ્તરનો સંપર્ક કરી શકશે. સ્ટેશન માસ્તર અન્ય સ્ટેશનથી જારી કરવામાં આવેલી ટિકિટ રદ કરી શકશે.

નગરપાલિકાની ચુંટણીનેલઈનેરાજકીય ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરાયું છે. જો બાદબાકી કરાયેલા નગરસેવકોને પક્ષોમાં ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કેબંનેપક્ષોદ્વારા કેટલાક જુના જોગીઓને જિલ્લા સંગઠનમાં સન્માનિત હોદા કરવાની ગતિ તેજ બની છે. પાલનપુરમાં રીપીટ કરવાની તૈયારી કરાઈ છે. જ્યારે આપવાની પણ આગેવાનો દ્વારા લાલચ અપાઈ છે. જો કે હાલમાં આ મામલાને શાંત પાડવા જિલ્લા સંગઠન સહીતના આગેવાનો કામે લાગ્યા છે. ત્યારે આવનારા સમયમાં રાજનીતિના નવા આયામો કેટલા અંશે સાચા પુરવાર થશે એ તો સમય જ બતાવશે.

> નહેરુનો દાખલો આપતા મનમોહનસિંહે કહ્યું હતું કે, નવિનીકરણ, ટેકનોલોજી અને સ્પર્ધા માટે કોઈપણ સમાજને ઉદાર રહેવાની બાબત ખૂબ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં અસહિષ્ણુતાના મુદ્દા ઉપર કલાકારો તેમના રાષ્ટ્રીય એવોર્ડ પરત કરી ચુક્યા છે.

સાનેસ્પ તાવાતકઠા

અનુસંધાન પહેલાનું ચાલુ

ઉમેદવારે ઉમેદવારીપત્રની સાથે તેમના સંતાનો અંગે તેમજ સરકારી-ખાનગી લેણા અંગે બે અલગ-અલગ એફિડેવિટ આપવાની રહેશે. આ ઉપરાંત તેમના નિવાસસ્થાને શૌચાલયની સુવિધા અંગે નગરપાલિકા માટે ચીફ ઓફિસર અને પંચાયત માટે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

તેમણે જણાવ્યું હતું કે પંચ દ્વારા ઉમેદવારોની ખર્ચ મર્યાદા નિયત કરામાં આવેલ છે અને નિયત થયેલ સમયે તેમને તેમના હિસાબો સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવાના રહેશે.

આ ચૂંટણીમાં પંચાયતની ચૂંટણીમાં સ્ટાફને ફરજ પર મોકલવા માટે ૮૧ રૂટ તેમજ નગરપાલિકા માટે ૧૪ રૂટ નિયત કરવામાં આવેલ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર સંપૂર્ણ ચૂંટણી મોડમાં આવી ગયેલ છે. આચારસંહિતા ભંગની એક પણ ફરિયાદ તંત્રને હજુ સુધી મળી નથી. આ માટે નોડલ ઓફિસરની નિમણુંક પણ કરી દેવામાં આવી છે.

કંપનીની માંગ 🗨 અનુસંધાન છેલ્લાનું ચાલુ

નાણાંની હેરફેર પર પણ તંત્ર બાજ નજર રાખશે. આ માટે ૧૫ જેટલા સ્થાનો પર ખાસ નાકાબંધી કરવામાં આવી છે. જ્યારે શંકાસ્પદ વાહનોની ચકાસણી કરવામાં આવશે.

ખતરારૂપ

● અનુસંધાન પહેલાનું ચાલુ

અસહમતિ અથવા બોલવાની આઝાદીને દબાવવાથી દેશના આર્થિક વિકાસને નુકશાન થશે અને તેની સામે ખતરો ઉભો થશે. સ્વતંત્રતા વિના મુક્ત બજારનો કોઈ મતલબ નથી. સિંહે કહ્યું હતું કે, કોઈપણ ધર્મ કોઈપણ સાર્વજનિકનિતી માટે આધાર બની શકે નહીં. ધર્મ એક અંગત મામલો છે. જેમાં રાજ્યની સાથે-સાથે કોઈની પણ દરમિયાનગીરી યોગ્ય નથી. ધર્મ નિરપેક્ષતા આસ્થાનો એક હિસ્સો છે. નાગરીકોની મૂળભૂત સ્વતંત્રતાનું રક્ષણ થાય તે જરૂરી છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, એક્તા અને વિવિધતા માટે સન્માન, ધર્મ નિરપેક્ષતા અને બહુમતિવાદ કોઈપણ લોકશાહીના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ હોય છે. પૂર્વ વડાપ્રધાને આ પ્રતિક્રિયા એવા સમયે આપી છે જ્યારે દેશમાં અસહિષ્ણુતાનું પ્રમાણ વધી રહ્યું છે. જુદા જુદા ક્ષેત્રોની હસ્તીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તર્કવાદી કલબુર્ગીની હત્યા, ગૌમાંસની હત્યા ઉપર દાદરીમાં થયેલી હત્યા બાદ દેશમાં ધર્મનિરપેક્ષતા જાળવી રાખવા માટે સરકારની ભૂમિકા ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ મામલા ઉપર પોતાની વિચારધારા રજુ કરતા સિંહે કહ્યું હતું કે, કેટલીક હિંસક ઘટનાઓ હાલમાં બની છે. અભિવ્યક્તિ ઉપર અંકુશ મુકવાના પ્રયાસ થઈ રહ્યા છે. દુઃખદ ઘટનાઓને હાલમાં અંજામ આપવામાં આવી છે. કોંગ્રેસના સૌથી મોટા નેતા અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ

ગાંધી ૧૦૦ (૪ પાનાનું ચાલુ…)

આશા વ્યક્ત કરતા તેઓ તર્ક રજૂ કરે છે કે વિદ્યાર્થીની ઉપર ઇંગ્રેજી શીખવાનો બોજો ઓછો રહેશે એટલે બચતા સમયમાં જે ઉપયોગી જ્ઞાન ગ્રેજ્યુએટને મળે છે તે તેમાં અપાઈ જશે. પરિક્ષા ભયમાંથી વિદ્યાર્થીને મુક્ત કરવામાં આવશે. દરેક વિદ્યાર્થીની તપાસ થતી રહેશે પણ તે શાળાના જ શિક્ષકો મારફતે. (Only Internal Exams !) એમ આજના વર્તમાનનો સંદર્ભે નોંધવું પડે.)

આજે યુ.જી.સી.એ લાગુ કરેલી અધ્યાપકો માટેની કામગીરી ગુણાંકન પદ્ધતિ (API) સંદર્ભે ગાંધીની શિક્ષક વિશેની વાત એક જ વાક્યમાં સમાઈ જાય છે. ગાંધીએ કહ્યું છે - 'શિક્ષકમાં ઝવેરાત હશે તો શિક્ષણનો યાંત્રિક ભાગ છે એ તો સહુને મળી રહેશે.' અને વિદ્યાર્થી જયારે શાળામાંથી બહાર નીકળે ત્યારે તેની શક્તિનો વહેવારમાં ઉપયોગ કરે એ જ તેના શિક્ષકનું ખરું માપ ગણાશે. નોકરીએ વિદ્યા શીખવાનો હેતુ છે એ વહેમ દરેક પ્રસંગે દૂર કરવાાં આવશે. શિક્ષણણાં વિદ્યાર્થીને થોડાં જ વર્ષોમાં એવો જુસ્સો આવવાનો સંભવ છે કે તેને પોતાની આજીવિકાને વિષે શંકા કે ભય નહીં રહે. આ શાળામાં ફી નહીં લેવામાં આવે એવી છેલ્લી પણ મહત્ત્વની વાત કરતાં મહાત્મા ગાંધીની વાતમાં આજના શિક્ષણ થકી નોકરી મળશે? એવા વાલીઓ, સરકાર અને ખુદ વિદ્યાર્થીઓને મૂંઝવનારા પ્રશ્નના ઉકેલની વાત પણ આવી જાય છે. (સંદર્ભ : ગાંધીજીનો અક્ષર દેહ, ભાગ-૧ ૩, ૨૪૨, રાષ્ટ્રીય ગુજરાતી શાળા, પૃષ્ઠ : ૩૦૬ થી ૩૦૮.)

(લેખક સમાજશાસ્ત્રના અધ્યાપક છે.)

શ્રી યાદવે જણાવ્યું હતું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મોબાઈલ પેટ્રોલીંગ, ક્વીક રિસ્પોન્સ ટીમ અને સ્ટ્રાઈકીંગ ફોર્સની ટીમ પણ રચી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસની સાથે હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવશે.

પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે ૧૭ટકા જેટલા પરવાના ધરાવતા હથિયારો જમા થઈ ચુક્યા છે. બાકીના આ સપ્તાહમાં થઈ જશે. તેમણે જણાવ્યુ હતુ કે જિલ્લામાં હાલ કોઈ અશાંતિ નથી તેમજ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણ માટે સાનુકૂળ છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસોમાં જો કોઈ અસામાજિક તત્વો ખલેલ ઉભો કરવાનો પ્રયાસ કરશે તો કાયદો કાયદાનું કામ કરશે અને સપ્ત હાથે પગલાં લેવામાં આવશે.

કોલ્સ વધશે

રેલવે મેનેજર

• અનુસંધાન છેલ્લાનું ચાલુ

જયારે દિવાળી દરમિયાન ઇમરજન્સીને પહોંચી વળવા ૧૦૮ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યુ છે. ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં વધારાના રીસ્પોન્સ ઓફિસર અને ડોકટરની સેવા સાથે રાજયમાં ૫૫૦ જેટલી અત્યાધુનિક એમ્બયુલન્સ તાલીમબધ્ધ ઇ એમ ટી પાયલોટ અને અન્ય સુપરવાઇઝરની ટીમ સાથે તૈનાત રહેશે અલબત્ત ઇમરજન્સી કોલને પહોંચી વળવા પુરતી તૈયારી કરી દેવામાં આવી હોવાનુ જણાંવાયુ છે. દિવાળીના પર્વ દરમિયાન દાઝી જવાના કિસ્સા ઉપરાંત પેટના દુખાવા ઉપરાંત તાવ મારામારીના કેસોનુ પ્રમાણ પણ વધારે જોવા મળે છે. ગાંધીનગર જિલ્લામાં પણ સામાન્ય દિવસોમાં ઇમરજન્સી કોલનો ટ્રેન્ડ ૬૪ જેટલા કોલ્સનો હોય છે. જયારે દિવાળીના પર્વમાં ઇમરજન્સી કોલ્સની સંખ્યા ૨૪૦ થી પણ વધુ થાય તેવી શકયતા છે.

ભવ્ય દિપોત્સવ • અનુસંધાન છેલ્લાનું ચાલુ

આ દિપમાળાને જોવા માટે મુલાકાતીઓની ભારે ભીડ અક્ષરધામ મંદિર ખાતે ઉમટી પડશે. દિવાળી મહોત્સવની અક્ષરધામ ખાતે દર વર્ષે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. દિવાળીથી લાભ પાંચમ કે સાતમ સુધી દરરોજ સાંજે સમગ્ર પરિસરને હજ્જારો દિવડાઓથી શણગારવામાં આવે છે. આ દિપમાળા દિપોત્સવ મહોત્સવ દરમ્યાન હજ્જારો મુલાકાતીઓ આ પરિસરની મુલાકાત લે છે. ગાંધીનગર-અમદાવાદ ઉપરાંત દૂર દૂરથી પ્રવાસીઓ-મુલાકાતીઓની ભારે ભીડ અહી જામે છે. આગામી તા. ૧૦મીથી આ વર્ષના દિપોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. ૧૦મી નવેમ્બરે સાંજે પ.૪૫ વાગે ઉદ્ઘાટન સમારંભ યોજાશે.

• અનુસંધાન છેલ્લાનું ચાલુ

જયારે આ દરમિયાન તેમણે સ્ટેશન વિસ્તારની જગ્યાનો અભ્યાસ હાથ ધર્યો હતો. સ્ટેશન વિસ્તારમાં નવા શોપિંગ મોલ તેમજ હોટેલ બનાવવા હીલચાલ હાથ ધરાઇ હોવાનુ ધ્યાને આવ્યુ છે. ત્યારે કેપિટલ સ્ટેશનની આ મુલાકાત દરમિયાન તેમણે સ્થળ સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. વધુમાં કેપિટલ સ્ટેશનને વધુ ટ્રેઇનો ફાળવવામાં આવે તે માટે જરૂરી દરખાસ્ત તૈયાર કરવા પણ તેમણે સુચના આપી હોવાનુ ધ્યાને આવ્યુ છે.

Place: Gandhina

Date: 6th Novemb

The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meetings held on 6" November, 2015 Segment Revenue includes Other Income which is directly attributable to each segment

The statutory auditors have carried out a limited review of above results.

During the quarter, the Company has allotted 50,462 equity shares of Rs. 10 each to the eligible employees pursuant to GSPLESOP Plan 2010. The Gas volumes transported are as follows: (in MMSCM)

Year/period	Qtr 1	Qtr 2	Total
Financial Year 2015-16	2201.19	2236.81	4438.00
Financial Year 2014-15	2023.44	2226.92	4250.36

(6) The figures for the corresponding previous periods have been restated / regrouped, wherever necessary, to make them compared

agar			
ber, 2015			

point	
	For, Gujarat State Petronet Limited
	Atanu Chakraborty, IAS
	Managing Director